



સંપાદકની ક્લમે

જાણીતા ગ્રીક ફિલસૂફ હિરાકલેટસે ખૂબ જ સુંદર અને માર્મિક વાત કરી કે; “આ જગતમાં કશું જ કાયમી નથી; કાયમી છે તો માત્ર એક જ ચીજ કાયમી છે અને એ છે પરિવર્તન” અર્થાત્ આ જગત સતત પરિવર્તનશીલ છે અને પરિવર્તનની આ પ્રક્રિયાનો કદીય અંત આપવાનો નથી! સતત આકાર લેતા પરિવર્તનો સાથે માણસજાતે તાલ મેળવવાનું અનિવાર્ય થઈ પડે છે, જે સમાજ કે રાષ્ટ્ર પરિવર્તનને સમજવામાં મોળો પડે છે. એને ભવિષ્યની પેઢી કદી માફ કરતી નથી. બદલાતા જતા સમય સાથે માણસને અનુકૂળ સાધવામાં મદદરૂપ થઈ શકે અને એને સક્ષમ બનાવી શકે એવાં કેટલાક પરિબલો છે. આ પરિબલોમાં શિક્ષણ સૌથી વધારે પ્રભાવક અને નિર્ણાયક પરિબલ છે.

પ્રત્યેક સમયે અને સ્થળે બદલાતા સમય સાથે માણસજાતને સક્ષમ બનાવવા સંદર્ભે શિક્ષણે મહત્વપૂર્ણ યોગદાન આપવાનું રહે છે, અને અસરકારક ભૂમિકા અદા કરવાની રહે છે. આ માટે એ જરૂરી છે કે શિક્ષણક્ષેત્રે આવતા પરિવર્તનોનો પ્રવાહને યોગ્ય વાચા મળે અને એ પ્રવાહો સૌ સંબંધિત પક્ષકરો સુધી યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પહોંચી શકે. આ દિશામાં પોતાનું ચત્કિચિત પ્રદાન કરવા ‘શિક્ષણ દર્શન’ સતત પ્રતિબદ્ધ રહ્યું છે અને ભવિષ્યમાં પણ એ લક્ષ્યને કેન્દ્રમાં રાખીને પોતાનું પ્રદાન કરતું રહેશે. એ જ પરિપ્રેક્ષ્યમાં ‘શિક્ષણ દર્શન’ પુનઃ આપ સૌની સમક્ષ ઓક્ટોબર-ડીસેમ્બર-૨૦૧૮ નો અંક લઈને ઉપસ્થિત થયું છે.

‘શિક્ષણ દર્શન’ નાં પ્રસ્તુત અંકમાં લેખકોએ પોતાની ક્લમનો કસબ પ્રગટ કર્યો છે અને ખૂબ જ આવશ્યક એવાં વિષયોને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. પ્રસ્તુત અંકમાં કુલ 12 લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે, લેખકોએ પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીના શિક્ષણના વિવિધ પાસાંઓને ઉજાગર કર્યો છે. શિક્ષણનાં બદલાતા પ્રવાહોને સમજવામાં અને તદઅનુસાર અપેક્ષિત સજ્જતા કેળવવામાં ‘શિક્ષણ દર્શન’ નો આ અંક સૌ સુજા વાચકોને જરૂરથી ગમશે અને ચર્ચાઈ જણાશે એવી પૂર્ણ શ્રદ્ધા છે.

શિક્ષણક્ષેત્રે જે અદ્યતન પ્રવાહો આકાર લઈ રહ્યા છે એને સ્પર્શતા લેખોને આવકારવાના જ હોય ને ! અસ્તુ.